

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૫/૦૫/૨૦૧૬ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૬૫/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૫ કેસ કરી, ૧૭ વ્યક્તિઓને ઝડપી, ૬૭ લીટર દેશી દારૂ, ૩૧ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૦૫ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૩૯૯૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૬૬/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડી:-

સમાચાર યાદી નં.૯૬૭/૧૬

મણીનગર :- (૧) પ્રસન્નાભાઈ પ્રહલાદભાઈ ચૌધરી (ઉ.વ.૩૮) (રહે.શિલ્પ એપાર્ટમેન્ટ, જગાભાઈ પાર્ક, મણીનગર) એ તા.૨૪/૫/૧૬ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૧૧/૨૦૧૪ થી આજદીન સુધીનાં સમયગાળા દરમ્યાન આરોપી (૧) વગતારામ શૈષરામજી દરજી (રહે.તળિયાની પોળ, દરીયાપુર) (૨) ગોવિંદલાલ જોરારામ દરજી (રહે.વૃંદાવન રેસીડન્સી, મોટેરા સ્ટેડીયમ રોડ, મોટેરા) નાઓએ પ્રસન્નાભાઈની બેંકમાંથી કુલ રૂપિયા ૪૩,૦૦,૦૦૦/- ની લોન મેળવી, લોનની રકમ પરત નહીં ચુકવી, પ્રસન્નાભાઈની બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.વી.બારીયા ચલાવે છે.

(૨) દેવરાજસિંહ અજીતસિંહ અટાલિયા (ઉ.વ.૪૧) (રહે.સારથી કોમ્પ્લેક્ષ, રાધાવલ્લભ મંદિર પાછળ, મણીનગર) એ તા.૨૪/૫/૧૬ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૭/૨૦૦૯ થી તા.૨૩/૪/૨૦૧૨ સુધીનાં સમયગાળા દરમ્યાન આરોપી (૧) ભરતભાઈ રતિલાલ શાહ (૨) પાડુલબહેન રતિલાલ શાહ (૩) કૃતેશભાઈ ભરતભાઈ શાહ (તમામ રહે. શાંતિ એપાર્ટમેન્ટ, દેવાશીષ સ્કુલ પાસે, બોડકદેવ) એ ભેગામળી દેવરાજસિંહને વિશ્વાસમાં લઈ ધંધાનાં વિકાસ અર્થે કુલ રૂપિયા ૧૫,૨૯,૫૦૦/- મેળવી, પરત રૂપિયા નહીં ચુકવી, દેવરાજસિંહ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.વી.બારીયા ચલાવે છે.

રામોલ : મુકેશભાઈ પુખરાજભાઈ મેવાડા (રહે.સ્વામીનારાયણ પાર્ક, નિગમ રોડ, ઘોડાસર, વટવા) એ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૫/૧૬ રાતનાં ૧૦/૦૦ થી તા.૨૪/૫/૧૬ સવારનાં ૮/૪૫ વાગ્યા દરમ્યાન વસ્ત્રાલ રતનપુરા ગામ સામે, શિવદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલ રામદેવ કિરાણા સ્ટોર્સ નામની પોતાની દુકાનનું શટર ઉંચુ કરી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, દુકાનમાંથી કરીયાણાની અલગ-અલગ ચીજ-વસ્તુઓ અને રોકડ રૂપિયા ૨૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૫,૧૧૩/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી ડી.એમ.ચૌહાણ ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ :

સમાચાર યાદી નં.૯૬૯/૧૬

ઓઢવ : આશાબેન વા/ઓ અશ્વિનભાઈ હડીયલ (ઉ.વ.૩૧)(રહે,હનુમાનનગર ગીતા ગૌરી સીનેમા પાછળ, ઓઢવ) તથા અશ્વિનભાઈ મગનભાઈ હડીયલ (ઉ.વ.૩૫) નાઓ તા.૨૩/૫/૧૬ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન આશાબહેનનું તા.૨૪/૫/૧૬ રાતનાં ૦૦/૩૦ વાગે તેમજ અશ્વિનભાઈનું તા.૨૪/૫/૧૬ બપોરનાં ૪/૧૫ વાગે મૃત્યુ નિપજ્યુ છે. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી મુકેશસિંહ જગરૂપસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.